

આપાત્મજળી જેતી :

વૈશાખ સુદ - ગ્રીજ



આ જેતી નવા ઘઉની રોટલી અને ધી-ગોળ થી થાય છે.

પૂજા માટે સાધન

: થાળી, ઝમાલ, ૨- વાડકી, પાટલો, લોટામાં પાણી, દીવી, કંકાવટી, ધૂપદાની, (મરળયાત), હાથધોવા માટે વાસણ, ગેપડીન.

પૂજા માટે સામગ્રી

: કંકુ, ચોખા, કાચી સોપારી, અગરબત્તી, ધૂપ ફૂલ અને ઘરો.

વસ્તુ બનાવવા માટે સાધન

: ઓરસીયો, પેલણ, તવો, આટો ચાળવાની ચાળણી.

વસ્તુ બનાવવા માટે સામગ્રી

: ૫૦૦ ગ્રામ (સવા શેર) ઘઉ, ૨૫૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ ધી.

રોટલી બનાવવાની રીત

: ૫૦૦ ગ્રામ (સવા શેર) ઘઉ દળાવી, આટો ચાળી અટામણ જુદુ કરવું. ચાળોલા આટામાં મીઠું નાખ્યા વગર રોટલી બનાવવા માટે જોઇએ તેવો લોટ બાંધવો. રોટલી પણી તવા ઉપર કુલાવવી. રોટલી બણે નહીં તેનું દ્યાન રાખવું. રોટલી ધી થી ચોપડવી. કેટલાક કુદુરુંનો પૂજા કર્યી વખતે રોટલી ચોપડે છે. અટામણ જેતી થઈ ગયા પછી જ ઘરમાં વાપરવું.

થાણીમાં નીચે પ્રમાણે સામગ્રી ગોઠવીને મુકવી:-

- (૧) સાત રોટલી (બનાવેલી રોટલીઓ માંથી) (૨) વાટકીમાં જોળ (૩) વાટકીમાં ધી (૪) પાણીનો લોટો
(૫) કંકાપટી કંકુ તથા ચોખા (૬) સોપારી (૭) ફૂલ અને ઘરો (૮) અગરબંટી (૯) ધૂપ

આ બધી સામગ્રી ગોઠવી, ઉપર સ્વરચ્છ રૂમાલ ઢાંકી દેવો. નકડી કરેલી જગ્યાએ પાટલાની સ્થાપના કરવી. દિવાલ પર ચાંદલા કરવાના હોય તો તૈયાર કરેલી થાણી પાટલા પર મુકવી.

જેતી કરવાની રીત:-

હીરાણી કુઠુંબો જગ્યારે પાલણપુરમાં રહેતા હતાં ત્યોરે માતાજી ની મેડીએ જઈ જેતી કરતા હતા. પાલણપુર માં હ્યે ને ચાર હીરાણી કુઠુંબો રહ્યાં છે. બણાર રહેતા કુઠુંબો ઘરમાં નકડી કરેલ જગ્યાએ દિવાલ અથવા પાટલા ઉપર જેતીની વિધિ કરે છે. પાટલા ઉપર થતી જેતીને પાટલા જેતી કહેવાય છે.

- (૧) ઘરમાં જેતી દિવાલ ઉપર કરવાની પ્રથા હોય તો દિવાલ અને પાટલા ઉપર કરવાની પ્રથા હોય તો પાટલો મુકવાની જગ્યા સ્વરચ્છ પાણી થી ધોઈ ને સાફ કરવી.
(૨) માતાજીની સ્થાપના રૂપે ધીનો દીવો પ્રગટાવવો, અને માતાજીનું સ્મરણ કરી અગરબંટી અને ધૂપ કરવો (ધૂપ મરજુઆત છે).
(૩) કંકાપટીમાં કંકુ પલાણી દિવાલ અથવા પાટલા પર પાંચ ચાંલ્લા કરી ચોખાથી વધાવવા.
(૪) સોપારીની પાટલા પર સ્થાપના કરી ચાંલ્લો કરી ચોખા લગાડવા.
(૫) પાંચ ચાંલ્લા કરેલ જગ્યા પર પાંચ ભાગ ફૂલ અને ઘરો ચઢાવવા.

- (૬) સાત રોટલી સાથે રાજી, વચ્ચે ગોળ મુકી તેના ઉપર ધી લગાવી રોટલીઓ અર્ધ લાગદી વાળી પાંચ ટુકડા કરી ચાંલ્સ કોરેલી જગ્યાએ થણ્ણવા.
- (૭) પાટલા ને ચોરે બાજુ જમણી તરફથી શરૂ કરી જળાધારી કરી માર્જન કરવું. (માર્જન કરવું એટલે જગ્યાની મર્યાદા બાંધવી).
- (૮) જેતી કરનોર પોતે, પોતાને ચાંલ્સો, ચોખા લગાડવા અને હાજર રહેલા કુટુંબના દો઱ સત્યને ચાંલ્સો કરવો.
- કેટલાક કુટુંબોમાં જેતી કરતી વખતે ઘરના દો઱ સત્ય સાથે જેસે છે અને જેણ સ્તુતિ-સ્તાવન કરે છે. આ રીતે જેતીની વિધિ પૂર્ણ થાય છે.

જેતીનો પ્રસાદ

માતાજીની જેતી માટે બનાવેલ પસ્તુ, માતાજીને ઘરાવ્યા પછી પ્રસાદ કહેવાય. પ્રસાદ નો ઉપયોગ કરતાં પહેલાં હીરાણી મહેતા કુટુંબો પ્રથમ કુંપાસી ને જેતી ચખાડે છે અને ત્યાર પછી જ પ્રસાદનો ઉપયોગ કરે છે. સમય અને ર્થયાને અનુસરી ને કેટલાક કુટુંબો માં ફેરફાર નીચે પ્રમાણે છે. તેમ છતાં કુંપાસીની અગત્યતા જળવાઈ રહી છે.

- (૧) કેટલાક કુટુંબોમાં જેતી માં ઘરાવેલી ખાવાની પસ્તુ અને સામગ્રી, જેતી ની સમાપ્તિ બાદ ગાયને ખવરાવી દે છે. ત્યાર બાદ કુંપાસી (બહેન, દીકરી, કઈ) ને ચખાડી, પછી જ ઘરના બધા સત્યો તે પસ્તુનો ઉપયોગ કરે છે.

- (૨) કેટલાક કુટુંબો જેતીમાં ઘરાયેલી ખાવાની વસ્તુ અને સામગ્રી, જેતીની સમાપ્તિ બાદ, દરિયા, નદી અથવા કુવામાં પદ્ધરાવી, ઘરના સાલ્યો તે વસ્તુનો ઉપયોગ કરે છે.
- (૩) કેટલાક કુટુંબો જેતી પહેલાં વાસણમાં થોડો વધ્યો લાગ રાજે છે અને જેતી પુર્ણ થઈ ગયા બાદ, કુંપાસીના ધેર તે લાગ તથા જેતી ઊઘાડા પતો (ચંપલ કે બુટ પહેર્યા વિના) આપવા જાય છે. જેતી ની તે થાળીને કુંપાસી સવા રૂપિયો અથવા સાત આખી બદામ અથવા સાત ખોરક મુકી વધાયે છે. કુંપાસીને ત્યાંથી આવ્યા બાદ ઘરના સાલ્યો તે વસ્તુનો ઉપયોગ કરે છે. જો કુંપાસી ન હોય તો જેતી જાયને ખવરાવી શકાય.
- (૪) કેટલાક કુટુંબો જેતી વખતે કુંપાસીને ધૈર બોલાયે છે, તે ઘરના બીજા સાલ્યો સાથે જેતી પ્રસંગે સાથે બેસે છે. જેતી બાદ પ્રસાદ કુંપાસીના ચાખ્યા બાદ ઘરના બધા સાલ્યો જેતી ચાંજે છે, અને પછી તે વસ્તુનો ઉપયોગ કરે છે. કુંપાસી ન હોય તો કોઈપણ કુમારીકાને બોલાવીને જેતી ચાખાડી શકાય. જેતીમાં ઘરાયેલી ખાવાની વસ્તુ અને સામગ્રી જેતી ની સમાપ્તિ બાદ (દીવો રામ થઈ જાય ત્યારો) જાયને ખવરાયે છે, અથવા નદી, કુદો કે દરિયામાં પદ્ધરાવી હોય છે.

બળેદાળી જેતી : આપણા સુદ પુનામ

આ જેતી ઓહો અને માતર (સુખડી-ગોળ પાપડી) થી ધાય છે.

પૂજા માટે સાધન અને સામગ્રી :-

અખાત્રીજ ની જેતી માટે લજેલ છે, તે પ્રમાણે, ઉપરાંત એક રાખડી

વસ્તુ બનાવવા માટે સાધન અને સામગ્રી :-

વાડકી, કડાઈ તાવીઠો, મોટો ચમયો (ટેબલ સ્પૂન) થાણી.

માતર બનાવવા માટે :- ૪૦૦ ગ્રામ ઘઉનો લોટ, ૨૫૦ ગ્રામ ધી, ૨૫૦ ગ્રામ ગોળ.

ઓહો બનાવવા માટે :- ૪૦૦ ગ્રામ ઘઉનો લોટ, ૨૫૦ ગ્રામ ધી, ૨૫૦ ગ્રામ દળોલી ખાંડ.

ઓહો અને માતર માટે મિશ્રણ :- એક માટો ચમયો, વરીયાણી / ઘઉં, કોપડ અને ગૂંદનું મિશ્રણ.

મિશ્રણ બનાવવાની રીત :- ગૂંદ, કોપડ, અને વરીયાણી અથવા ઘઉનું મિશ્રણ બનાવવા માટે વરીયાણી અથવા ઘઉં સાફ કરી ધીમા તાપે શેડવા, કોપડ છીણીને ધીમા તાપે શેડવું, અને ગૂંદને તળીને પુફકો કરેયો. કરેણે વસ્તુના સરખા વાગ નું મિશ્રણ હી તૈયાર રાખવું.



માતર બનાવવાની રીત :-

ધી ગરમ કરી તેમાં આટો નાખી, ધીરા તાપે ઘેરો બદામી રેગ થાય ત્યાં સુધી શોકવો. તેમાં જોળ કાતરી ને એકરસ થાય ત્યાં સુધી હલાવવો. ત્યાર બાદ થાણીમાં નાખી, વાડકીથી યેપી; તેના ઉપર વરીઆળી અથવા ઘઉં, અને કોપરાના તૈયાર કરેલા મિશ્રણમાંથી અર્ઘું લઈ પાથરી દબાવી હેઠું.

ઓહો બનાવવાની રીત :-

ધી ગરમ કરી તેમાં આટો નાખી, ધીરા તાપે શોકી, તેમાં દળોલી ખાંડ નાખી, બરોબર એકમેક થઈ જાય ત્યાં સુધી હલાવું. જરાબર શોકાઈ જયા પણી થાણીમાં નાખી, વાડકીથી યેપી, તેના ઉપર વરીયાળી અથવા ઘઉં, ગુંદ અને કોપરાનાં તૈયાર કરેલ મિશ્રણ નો બાકી વધેલો લાગ પાથરી દબાવી હેઠું. કેટલાક કુટુંબો ઓહાને યેપતા નથી, પરંતુ આટાની જેમ છુટ્ટો રખે છે.

જેતી કરવાની રીત :-

અખાત્રીજની જેતી માટે લખેલ વિધિ મુજબ, ઉપરાંત એક રાખડી મુકી જેતી કરવી. (શોટલીને બદલે) ઓહો અને માતર ના પાંચ લાગ (નાની ઢગલી) ચઢાવવા.

જેતીનો પ્રસાદ :-

અખાત્રીજની જેતી માં લખેલ છે તે પ્રમાણે ઉપયોગ કરવો, આ પ્રમાણે બળેવની જેતી પૂરી થઈ.



દશોરાની જેતી : આત્મો સુદ દશમ

આ જેતી રેશમીઓ થી થાય છે. રેશમીઓ બનાવવાની અનુકૂળતા ન હોથ તો આ જેતી જલેણીથી કરી શકાય છે.

પૂજા માટે સાધન અને સામગ્રી :-

અખાગ્રીજ ની જેતી માટે લજેલ છે, તે પ્રમાણે, ઉપરાંત કેટલાક કુટુંબો જ્વારા (જ્વારા એટલે મોટા ઝોડીયા માં માટી ભરી તેમાં ઘઉના દાણા રોપી ઉગાડવા) પણ મૂકે છે. જ્વારા નવરાત્રીના પહેલા દિવસે રોપે તે દશોરા સુધી તૈયાર થાય છે. કેટલાક કુટુંબો ઉગેલા ઘઉં પણ મૂકે છે. જ્વારે કેટલાક બન્નેમાંથી કોઈ જ ચીજ મૂકૃતા નથી.

વસ્તુ બનાવવા માટે સાધન અને સામગ્રી :-

કડાઈ, મોટી થાળી, તપેલી, ચમયો, ઝારો, ગ્લાસ, વાડકી, સવા ડિલો મેંદો, સવા ડિલો દળોલી ખાંડ.

રેશમીઓ બનાવવાની રીત :-

મેંદો ચાળી તેમાં આશેરે બે વાડકી ભરી ધીનું મોળ નાખવું- (ઓછું લગે તો વધ્યારે પણ નાખી શકાય) પછી નવાયા પાણીથી લાખરી બનાવવા માટેના લોટ જેવો બાંધવો. વીસ મીનીટ લગલગ પલળવા દઈ, આટાને મસળી, એક દિયની સાઇઝ ના ગોળ ઢા જેવી ગોળીઓ બનાવી કડાઈમાં ધી નાખી ધીમા તાપે તળવી. તળાઈ જાય એટલે ચાસણી બનાવવી.

ચાસણી બનાવવાની રીત :-

તપેલીમાં નિર્ધરીત માપની દળેલી ખાંડ લઈ તેમાં એક જ્લાસ પાણી નાંખી ગરમ કરવું. તેમાં એક ચમણો દુધ નાખવું. થોડીવાર ગરમ થયેથી, થોડો મેલ ઉપર આવશે, તે ચમણીથી કાઢી નાંખવો, ખાંડની ગોળી વળે તેવું મિશ્રણ થાય એટલે ઉતારી લેવું. આ તૈયાર થયેલી ચાસણીમાં લોટની બનાવેલી ગોળીઓ નાખી બરાબર હલાવવું જેથી ચાસણી બરોબર લોટની ગોળીઓ ઉપર પડની જેમ લાગી જાય. આ રીતે રેશમીઓ તૈયાર થઈ, તેને ઠંડી થયા બાદ ડન્બામાં ભરી દેવી.

જેતી કરવાની રીત :-

અખાત્રીજ ની જેતી માટે લજેલ વિધિ મુજબ, (રોટલી ના બદલે) રેશમીઓ ચઢાવવી. ઉપરાંતમાં જવારા અથવા ઘઉં પાટલાની બાજુમાં મુકી જેતી કરવી (કિટલાક કુટુંબો બન્નેમાંથી એક પણ મૂકૃતા નથી).

જેતીનો પ્રસાદ :-

અખાત્રીજની જેતીમાં લજેલ છે તે પ્રમાણે ઉપયોગ કરવો આ પ્રમાણે દરોરાની જેતી પૂરી થઈ.

ઘનતેરશાની જેતી : આસો વદ તેરસ



આ જેતી ખીર થી થાય છે.

પૂજા માટે સાધન અને સામગ્રી :-

અખાત્રીજની જેતી માટે લજેલ છે, તે પ્રમાણે, ઉપરાંત ચોટીવાળું શ્રીકૃષ્ણ અથવા સુકા નાળીયેર નો ગોળો.

વસ્તુ બનાવવા માટે સાધન :-

તપેલુ, ચમચો

વસ્તુ બનાવવા માટે સામગ્રી :-

૧ લિટર દૂધ, ૧૦૦ ગ્રામ ચોખા, ૧૦૦ ગ્રામ ધી, ૫૦ ગ્રામ દળોલી ખાંડ

ખીર બનાવવાની રીત :-

તપેલીમાં દૂધ ઉલસે આયે ત્યાં સુધી ઉકાળયું. ચોખા ધોઇને તેમાં નાખવા અને હલાવતા રહેયું, ચોખા સીજુ જાય ત્યારી નીચે ઉતારી લેવી.

જેતી કરવાની રીત :-

અખાત્રીજની જેતી માટે લજેલ વિધિમુજબ પૂજા કરવી. જેતી કરવા માટે થોડી ખીર તપેલીમાં લાવી રાખવી, માતાજીને ખીર થઢાવતા પહેલા ખીરમાં દળોલી ખાંડ અને ઉપર ધી નાળી, ધી, ખાંડ, ખીર સાથે

આવે તે રીતે પાંચ ભાગ ચઢાવવા. ચોટીવાળા શ્રીકણ અથવા સૂક્ષ્મ નાળિયેરણાં ગોળા ઉપર સાથીયો અથવા ચાંલો કરી પૂજામાં મુક્કવું. દિવાળીની જેતી માટે દળ કરવાનો હોય તો સાથે દળનો શેડેલો દાણો (જુઓ દિવાળીની જેતી) એક વાટકીમાં લઈ તેમાં દળોલી ખાંડ તથા ધી લેળવી જેતીના સમયે મુકવો. પૂજા થઈ જાય ત્યારે શ્રીકણ અથવા ગોળા દળના વાસણમાં અથવા દળ ન કરવાના હોથતો સાચવી ને દિવાળીની જેતી માટે રાખવો. દિવાળીની જેતી માટે દળ કરવાનો હોય તો ઘનતેરણની જેતી કર્યા પછી સારા મુહૂર્તમાં દળ ફીણવા લેવો.

જેતીનો પ્રસાદ:-

અખાતીજની જેતી માટે લખેલ તે પ્રમાણે ઉપયોગ કરવો. આ પ્રમાણે ઘનતેરણની જેતી પૂર્ણ થઈ.

દળ ફીણવા માટે સાધન:-

મોટો થાળ અથવા કથરોટ

દળ ફીણવા માટે સામગ્રી (૮ કિલો મેંદા માટે):-

૨.૫ કિલો ખાંડ - ૨.૫. કિલો ધી

દળ ફીણવાની રીત:-

દળોલી ખાંડ અને ધી ને થાળ અથવા કથરોટમાં લેગું કરી હણેળીથી ખુબજ ફીણવું. સરસ સેફેન્ડ મિશ્રા તૈયાર થશે તેમાં તૈયાર કરેલ દળનો દાણો નાળી લેળવી બરોબર એકમેક કરવો અને સારી રીતે પેક કરી મુકી હેવો, કેટલાક કુટુંબો તે દળના મોટા સાત લાડવા કરીને મુકી રાજે છે.

દિવાળીની જેતી પહેલા આ દળ ચખાય નહીં તેમજ તેને પર્વિત રેણ તેમ રાખવો.

દિવાળી જેતી :

આસો પદ અમારા



આ જેતી દળ, દોઠાં અને મેંદા ના જુદા જુદા ઘાટના બગાવેલા અકડાંની થાય છે. દળને પૂર્ણસાઈ કહેવાય છે. દળ બનાવવાની અનુકૂળતા ન હોય તો દળના બદલે મોતીયુર અથવા મીઠાઈ પણ વાપરી શકાય.

પૂજા માટે સાધન:

ધાળી, રૂમાલ, વાડકી, પાટલો, લોટામાં પાણી, ગેપકીન, દીવી, કંકાપટી, ઘૂપદાની (મરજુયાત), હાથ ધોવા વાસણા, સાત અથવા નવ કોડીયાં, રૂ અથવા વાટ, મોટો થાળ, અને મેરાયા માટે સમી (ખીજુડો) અથવા શેરકી ની ૨ ઈંચ X ૧૮ ઈંચની લાકડી, ૧/૨ ઈંચ X ૫ ઈંચ લાકડાના બે ટુકડા, ૧૦૦ ગ્રામ તેલ, મારી અને વાટ બનાવવા કપડું.

પૂજા માટે સામગ્રી:

કંકુ, ચોખા, કાચી સોપારી, ફૂલ, ધરો, અગરબટી, દુપ, સાત નાગરયેલનાં અણી શુદ્ધ પાન (પાન ની ઉપરની ઢાંડી થી નીચેની અણી સાથે) પાંચ ચાંદીના રોકડા રૂપિયા, બોર, ડોડી, ટીડીના, ચોળાફળી, (છેલ્લા પાંચમાં થી જે મળે તે ચાલે) એક ચમયો ધાણી અને ચણા અથવા સાકર, ૧૨૫ ગ્રામ મિઠાઈ, ૧૨૫ ગ્રામ ઘાટ અથવા પતાસાં અથવા સાકરીયા ચણા.

દળ અને દોઠાં બનાવવા માટે સાધન:

કથરોટ, મેંદા ચાળણી, ચોખા ચાળણી.

દળ બનાવવા માટે સામગ્રી:

૮ કિલો મેંદો (જુના રીવાજ પ્રમાણે) ૧.૨૫૦ કિલો ઘી.

દોઠા બનાવવા માટે સામગ્રી:

૫૦૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ ઘી મોળા માટે, ૪૦૦ ગ્રામ ઘી તળવા માટે.

દળ બનાવવાની રીત:

મેંદા-ચાળણી વડે મેંદો ચાળી, તે કથરોટમાં લઈ, ૧.૨૫૦ લીટર નવાયું પાણી અને ૧.૨૫૦ કિલો ઘી નાંખી બરોબર હુલાવી ઘાબો આપવો. (ઘાબો આપવો એટલે બરોબર લેળવી, દબાવી, રહેવા દેવું). પંદર મિનીટ પછી લોટને મસળી ચોખા ચાળણી થી દાણો પાડવો. દાણો પડતો જાય તેમ તેમ કડાઈમાં દાણાને ઘીમા તાપે આછો ગુલાબી થાય ત્યાં સુધી રોકી નીચે ઉતારવો, અને ચોખા ચાળણી થી દાણો ચાળવો. કે ચાળણીની ઉપર રહી જાય તેને હાથથી લાંબી પાછો ચાળી ને લઈ લેવો. ઠંકો થાય ત્યારે ડબલામાં બરી દેવો.

આ દાણા ને પુરસાઈ કહેવાય છે. દિવાળીના આઠ-દસ દિવસ પહેલાં સારુ મુહૂર્ત જોઈ આ દાણા બનાવી શકાય. અને ઘનતેરણની જેતી કર્યા પછી દાણાને ફીણવો. (ફીણવાની રીત ઘનતેરણ ની જેતી માં આપેલ છે.) આ દાણો, દંગેલી ખાંડ અને ઘી સાથે બરોબર ફીણાઈ તૈયાર થાય તેને દળ કહેવાય.

દોઠા બનાવવાની રીત:

મેંદામાં ઘીનું મોળા નાખી, નવાયા પાણીથી પૂરીના લોટ જેવો કઠણ લોટ લાંઘવો, લોટને બરાબર મસળી ઝીણા લીના કપડામાં અર્ધો કલાક ઢાંકી રાખવી લોટ સુકાય નહીં તેનું દ્યાન રખવું ત્યાર બાદ લોટને ફીણવાર મસળી નાના નાના લુઞા કરવા અને પહેલા સાત દોઠાં પુરી જેવા વણ્ણા. વણીને તેને ચપટીઓ

ભર્ત્વી જેણી તળતી વખતે કુલે નહીં. આ લોટ માંથી નાગા નાગા નીચે પ્રમાણે દેરેક ઘાટનાં સાત અકડાં બનાવવા : (૧) તપેલી (૨) બાંડણા (૩) વેલણ (૪) ચમચા (૫) ધુઘરા (૬) શીગોડા (૭) પાનના બીડાં (૮) શક્કર પારા (૯) પોટલી (વહેલી પુરીમાં ગોળ મૂકીને પોટલી બનાવવી) (૧૦) ચોટલો (૧૧) ચુંયણી (૧૨) પાટણની પોળ (૧૩) ખરમાં (સુપડા ઉપર હુઅ૰ દાબી બે લાટ પડે તે) (૧૪) સૌપારી (૧૫) ઓર્સ્સીયો (અકડાંના ઘાટ જેટલા બની શક તેટલા કરાય) ઉપર મુજબ બનાવ્યા પછી બાકી રહેલ લાટની નાની પુરી વહી, ચુપટીયો ભરી, બધી પુરીઓ, અકડાં, દોઠા વિઝેરે સુકવવા દેવાં, ત્યાર બાદ ધીમાં તળવા, લાલ થવા દેવા નહીં, ઠડા થાય એટલે ભરી દૈવાં. કેટલાક કુટુંબો અકડાંના ઉપર લખેલ ૧૫ ઘાટ થી વધારે ઘાટ બનાયે છે.

આરતીની થાળી :

દિવાળી જેતી સાંજે થાય છે. સાંજની જેતી વખતે માતાજીની આરતી કરીએ છીએ. તે માટે બપોરના સાત અથવા નવ કોડીયામાં પાણી ભરી એક થાળમાં મુકવા, કલાક પછી પાણી કાંઈ, કોડીયાં સુકવી નાખવાં, તે ની દિવેટ કોડીયા દીર્ઘ બનાવી ધીમાં બરોબર જીજવી દેવી. દેરેક કોડીયામાં ચાર દિવેટ મુકવી.

મેરાયું બનાવવાની રીત :

મેરાયું એટલે મશાલ. અગાઉના વખતમાં વીજળી અથવા બીજા દીવા નહોતા, અને દિવાળીની જેતી સાંજે શરૂ થઈ મોકી રાત સુધી ચાલતી, તેથી મેરાયું તે જમાનામાં બહુ ઉપયોગી હતું. મેરાયું સમી (ખીજડા) ના જાડાના લાકડાનું બનાવ્યું. તે ન મળે તો શેરડીમાંથી બનાવતા. આશેરે ૨ હીંદુ જાડા અને ૧૮ હીંદુ લાંબા ટુકડાને ઉપથ્યી ૬ હીંદુ લાંબી ચાર ફાચર કરી તેમાં અર્ધો હીંદુ જાડા અને ૫ હીંદુ લાંબા જે લાકડાના ચીરા નાખવા. જેણી ચાર ફાચરો જુદી રહે તે ફાચર ઉપર કપડું લપેટી તેના ઉપર લીની માટી ચોપડી, સુકવી નાખવી. સુકાઈ જાય ત્યારે ઉપરના ભાગમાં કપડાની પાટ બનાવી તેલ નાખવું. તેલ બહાર ન જાય તેનું ધ્યાન રાખવું. મેરાયું જેતી થઈ જયા પછી આરતી કરવા માટે પ્રગતાવવું. (હૃદે મેરાયા ની પ્રથા નથી).

જેતી કરવાની રીત :

દિવાળીના દિવસે સવારે સારા યોધડીયામાં જેતીની જગ્યા સ્વચ્છ પાણીથી ધોવી, (કેટલાક કુટુંબો ધોયા પછી તે જગ્યા લીપે છે) અને રૂણ" X રૂણ" ની જગ્યા ઉપર લીની ખડીથી સાથીયો કરવો તેને છેડો લગાવ્યા કહેવાય છે, (છેલ્લા પાને સાથીયો બતાવ્યો છે.) સાંજે સારા યોધડીયામાં જેતી કરવી. જેતી કરતી વખતે પાટલો સાથીયાની ઉપર મુકવો, અને આખાત્રીજની જેતી માં લજેલ છે તે વિધિસર દીવો કરવો, કૂલ ધરો ચઢાવવા, અગરબદ્ધી કરવી. ઉપરાંત ધનતેરશ ના પૂજનનું શ્રીકળ પદ્મેશ્વરું, તેની શેષ પણ ચઢાવવી. દણ અને દોઠાના પાંચ લાગ, દેરક રમકડામાંથી એક, ઘાણી, બોર, કોઠમરુ, ડોડી, ટીડોળા વિત્તોર હોથ તે પણ ચઢાવવા. પાંચ પાન સાથે રાખી ઉપર સાથીયો કરી, પાંચ રૂપિયા ઉપર ચાંટલો કરી યોખાથી વધાવી પાન ઉપર મુકવા. કેટલાક કુટુંબો રૂપિયા મુકતાં પહેલાં તેને દુધે ધોઈ પછી પાણી થી ધૂએ છે.

આ પ્રમાણે જેતી થઈ ગયા બાદ થાળમાં રાજેલાં કોડીયા માં બધા જ દીવા પ્રગટાવી થાળી થી માતાજીની આરતી ઉતારવી. કેટલાક કુટુંબો ત્યાર બાદ મેરાયા થી પણ આરતી ઉતારે છે, અને મેરાથું ચાર રસ્તા ઉપર અધ્યાત્મા ઓટલા પાસે સુરક્ષિત મુકે છે.